



# જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર

સિદ્ધસર, વાયા વરતેજ, ભાવનગર-364060 (ગુજરાત)

Email : dietbhavnagar1@gmail.com / diet-bav@gujarat.gov.in

કમાંક: જિશિતાબ/CMDE /2024/ ૩૨૧૬- ૩૨૬૧

તા: 29-06-2024

પ્રતિ,

દી.પી.ઇ.શ્રી તથા બી.આર.સી.શ્રી તમામ જિલ્લો ભાવનગર તથા બોટાદ  
લાયઝનશ્રી ડાયટ તમામ  
જિલ્લો -ભાવનગર તથા બોટાદ

વિષય : ધોરણ 2 થી ૮માં વિદ્યાર્થીઓના વાચન-લેખન-ગણન વિકાસ માટે આયોજન  
કરવા બાબત...

સંદર્ભ : કમાંક / જુસીએન્ડટી/સીએન્ડટી/ 2024-25/ 13289-321 તારીખ- 27-6-24  
સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે NEP- 2020માં બાળકોને  
પાચાના કૌશલ્ય એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુકે લેખન તેમજ પાચાના  
ગણનના કૌશલ્યો એટલે કે FLN કૌશલ્યોમાં પારંગત બનાવવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવેલ છે  
જે સારું આપણા જિલ્લા ભાવનગર તેમજ બોટાદ માટે ધોરણ 2 થી ૮ના બાળકના વાચન, લેખન  
ગણનને વિકસાવવા બિડાણના પત્રોનો અભ્યાસ કરી સ્થાનિક જરૂરિયાતો મુજબના વાચન-લેખન  
ગણનના શિક્ષણકાર્ય, મૂલ્યાંકન અને મોનેટરિંગ માટેનું યોગ્ય આયોજન કરવાનું રહેશે. આ અંગે  
તમામ બી.આર.સી.શ્રી એ સી.આર.સી.શ્રી પાસેથી રિપોર્ટ મેળવી એકંદર રિપોર્ટ જિલ્લા શિક્ષણ અને  
તાલીમ ભવન ભાવનગરને તારીખ 06 જુલાઈ 2024 સુધીમાં મોકલી આપવાનો રહેશે.

સદર કાર્યને ટોચ અગ્રતા ધ્યાને લઈને આયોજન અને અમલીકરણ સત્તવે કરવાનું રહેશે.

સહકારની અપેક્ષા સહ..

પ્રાચાર્ય

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન  
ભાવનગર

#### બિંદાણ:

૧. કમાંક જુસીએન્ડટી/સીએન્ડટી/ 2024-25/ 13289-321 તારીખ- 15-6-24

૨. કમાંક / જુસીએન્ડટી/સીએન્ડટી/ 2024-25/ 13289-321 તારીખ- 27-6-24

#### નકલ સવિનય રવાના:

૧. માનનીય સચિવશ્રી, જુસીએન્ડટી, ગાંધીનગર

૨. પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભાવનગર તથા બોટાદ


૩. પ્રતિ, શાસનાધિકારીશ્રી, ભાવનગર, મહુવા અને બોટાદ

#### નકલ રવાના જાણ તથા અમલ સારું :

સી.આર.સી.શ્રી તમામ ભાવનગર તથા બોટાદ



Director



ગુજરાતી શિક્ષણ અને વિદ્યા વિભાગ

No. : GCERT/2024/1049 - 12543.

Gujarat Council of Educational Research & Training,  
'Vidyabhavan', Sector-12, Gandhinagar.  
Tel. No. : (079) 21256808-19

Date: 15-06-2024

પત્રિ.

જિલ્લા શિક્ષણાધિકારી-તમામ

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-તમામ

શાસનાધિકારી -તમામ

વિષય: ધોરણ 2 થી 8 માં વાચન, લેખન ગણન અંતર્ગત ઉપચારાત્મક શિક્ષણ કરવા અંગે...

ઉપરોક્ત વિષય સંદર્ભે આપ સુવિદિત છો એ મુજબ તમામ બાળકો પોતાના ધોરણ - વિષય અનુક્રમ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. આ માટે પ્રત્યેડ બાળકને વાચન, લેખન અને ગણનનાં મૂળભૂત કોશલ્યો આવકતાં હોય તે અનિવાર્ય છે. આ સબજ્ઞ રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આવા પ્રયત્નોના ભાગરૂપે ગત શૈક્ષણિક સત્રમાં ડેઝુયારી-માર્ચ 2024 દરમિયાન ધોરણ 1-2 નાં બાળકોનું વાચન, લેખન અને ગણન અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ નિદાન કસોટીનાં ધોરણ 3 થી 8 નાં સત્રાંત કસોટીનાં વ્યક્તિગત રિપોર્ટ કાર્ડ તેમજ સ્ક્રૂલ રિપોર્ટ કાર્ડ શાળાઓ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આ રિપોર્ટ કાર્ડનો અધ્યાસ કરતાં જણાશે કે ધોરણ 2 થી 8 નાં કચ્ચાં બાળકોને વાચન, લેખન ગણન અંતર્ગત ઉપચારાત્મક શિક્ષણની જરૂરિયાત છે. આમ, ધોરણ 1 અને 2 ની ગત વર્ષની નિદાન કસોટીના રિપોર્ટ કાર્ડ મુજબ આ વર્ષની શરૂઆતમાં અનુક્રમે ધોરણ 2 અને 3 માં વાચન, લેખન અને ગણન અંતર્ગત વ્યક્તિગત ઉપચારાત્મક કાર્ય થાય તે સુનિશ્ચિત કરશો.

ગત વર્ષની ધોરણ 3 થી 7 ની દ્વિતીય સત્રાંત કસોટીનાં પરિણામ/રિપોર્ટ કાર્ડના આધારે અનુક્રમે ધોરણ 4 થી 8 માં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય એ સુનિશ્ચિત કરશો.

સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ 3 થી 8 માં દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલ સ્વ-અધ્યયન પોથીની શરૂઆતમાં આપેલ વ્યાજ કોર્સ અંતર્ગત પણ મુખ્યત્વે વાચન-લેખન-ગણન તેમજ જે તે વિષયના અપેક્ષિત પૂર્વજ્ઞાન માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય ફાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરશો.

ધોરણ 2 થી 8 માં વાચન-લેખન-ગણન અંતર્ગત ઉપચારાત્મક શિક્ષણ માટે ઉપયોગી માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. આ માર્ગદર્શિકાનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણકાર્ય દરમિયાન થાય તે સુનિશ્ચિત કરશો.

નિયામક

GCERT

નિયામક

પ્રાથમિક શિક્ષણ

સેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

સમગ્ર શિક્ષણ

વિડાયા: વાચન, લેખન, ગણન અંતર્ગત ઉપચારાત્મક શિક્ષણકાર્ય માટેની માર્ગદર્શિકા

નિકલ સત્ત્વિનય રવાના:

માન. શિક્ષણ સચિવશ્રી (પ્રા. અને મા. શિક્ષણ), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

પ્રાચાર્ય- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-તમામ

31/2  
18/6/24

C M D E  
18/6/24

૧

ધોરણ 2 થી 8 માં વાચન, લેખન ગણન અંતર્ગત ઉપયારાતમક શિક્ષણ માર્ગદર્શિકા

શિક્ષક તરીકે આપણે હંમેશાં એવા પ્રયાસમાં હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ દરેક વિષયમાં પોતાના ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે. ખાસ કરીને, ધોરણ 3 પછી શિક્ષક તરીકે આપણને આપણા આ લક્ષ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ધોરણ 3 માં પ્રવેશતાં કેટલાંક બાળકો વાચન-લેખન અને ગણનનાં મૂળભૂત કૌશલ્યોમાં અપેક્ષિત સિદ્ધિ સ્તર ધરાવતાં નથી. ધોરણ 1-2 માં શિક્ષકોએ કરેલી મહેનતને લીધે થોડુંધણું શીખ્યાં હોય એવાં બાળકો પણ, ધોરણ 3 પછી વાચન-લેખનના યોગ્ય મહાવરાના અભાવને લીધે સતત પાછળ પડતાં જાય છે.

ધોરણ 3 માં પ્રવેશતાં તમામ બાળકો વાચન, લેખન, ગણનમાં અપેક્ષિત સિદ્ધિ સ્તર પ્રાપ્ત કરેલાં હોય તે સુનિશ્ચિત કરવા માટે ગત શૈક્ષણિક વર્ષ 2023-24ની શરૂઆતમાં (જુલાઈ 2023) અને વર્ષના અંતભાગમાં (કેબુઆરી-માર્ચ 2024) આપણે દરેક બાળકનું વ્યક્તિગત મૂલ્યાંકન કરીને ઉપયારાતમક શિક્ષણ કાર્ય પણ કર્યું છે. કેબુઆરી-માર્ચ 2024 દરમિયાન નિપુણ ભારત અંતર્ગત થયેલા નિદાનકાર્ય બાદ વિદ્યાર્થીઓ માટે ધોરણ 1-2 ના શિક્ષકોએ ઉપયારાતમક શિક્ષણ કાર્ય કર્યું જ હશે. ધોરણ 1 અને 2 પૂર્ણ કરીને અનુક્રમે ધોરણ 2 અને 3 માં પ્રવેશોલાં આ બાળકો માટેના ઉપયારાતમક કાર્યનું સાતત્ય નવા વર્ષના પ્રારંભથી જ સુનિશ્ચિત કરીએ.

ધોરણ 1 ની પ્રથમ ભાષાની પાઠ્યસામગ્રીમાં બધા અક્ષર આવી જાય છે. એ જ રીતે બીજા ધોરણમાં પ્રથમ ભાષાના સંદર્ભી, દંડરહિત અને વિશિષ્ટ જોડાક્ષર આવી જાય છે. તેથી ધોરણ 1 પૂર્ણ કરીને બીજા ધોરણમાં પ્રવેશતા અથવા ધોરણ 2 પૂર્ણ કરીને ત્રીજા ધોરણમાં પ્રવેશતા પ્રત્યેક બાળક પાસે વાચન-લેખન અંતર્ગત શું અપેક્ષિત છે તે નક્કી છે. મોટાભાગનાં બાળકો અપેક્ષા મુજબ વાંચી-લખી શકતાં પણ હશે. પરંતુ, શક્ય છે કે અમૃક અક્ષરો, જોડાક્ષરો કે માત્રાઓ ઓળખવામાં કે લખવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી હશે. કયા વિદ્યાર્થીને કયા અક્ષર ઓળખવા કે લખવામાં મુશ્કેલી છે એ તારવવા માટે શરૂઆતમાં થોડુંક મુખર વાચન અને શુંતલેખન કરાવીએ.

✓ ધોરણ 3 થી 7 પાસ કરીને અનુક્રમે ધોરણ 4 થી 8 માં આવેલાં બાળકોની ગત સત્રાંત પરીક્ષા(SAT)નાં દરેક વિષયનાં રિપોર્ટકાર્ડ પણ ઉપલબ્ધ છે. આ પેકી ગુજરાતી અને ગણિતનાં રિપોર્ટ કાર્ડ જોઈશું તો ખ્યાલ આવશે જ કે વાચન-લેખન અથવા સાદા ગણનની મુશ્કેલી કર્યાં

કયાં બાળકોને છે. આવાં બાળકોને વાંચતાં, લખતાં અને ગણતાં આવડતું હશે તો જ તેઓ પોતાના ધોરણ મુજબનું શિક્ષણ મેળવી શકશે.

શાળા શિક્ષણ અંતર્ગત વાચન-લેખન-ગણન કૌશલ્યો 'ગેટ રે' કૌશલ્યો છે. એટલે આ કૌશલ્યોનું પ્રેશેદ્વાર વટાવીને જ શાળા શિક્ષણના અન્ય વિષયોનું અધ્યયન અસરકારક બની શકે. શિક્ષક તરીકે આપણે હંમેશાં જાગૃત રહીએ કે વિદ્યાર્થીઓને એટલા માટે 'વાંચતાં શીખવવાનું' છે કે જેથી તેઓ ભવિષ્યમાં 'શીખવા માટે વાંચે' (Learning to Read for Reading to Learn)!

✓ વાંચતાં આવડવું એટલે વાંચીને સમજતાં આવડવું, લખતાં આવડવું એટલે લખીને (પોતાની વાત) સમજવતાં આવડવું. આપણા વિદ્યાર્થીઓને રોજબરોજના શિક્ષણ કાર્ય દરમિયાન આવી તક મળે તે સુનિશ્ચિત કરીએ.

વાચન-લેખન શીખવવાની જવાબદારી માત્ર લાખા શિક્ષકની નથી. બધા શિક્ષકો લાખા શિક્ષકો છે. વિદ્યાર્થીઓને વાંચતાં-લખતાં શીખવવા માટે શિક્ષક તરીકે આપણા નિયમિત વર્ગકાર્ય દરમિયાન આટલું જરૂર કરીએ.

- પાઠ્યપુસ્તકમાં આપેલી સૂચનાઓ વિદ્યાર્થીઓ માટે છે, શિક્ષક માટે નથી. તેથી પાઠ્યપુસ્તકમાં આપેલી સૂચનાઓ શિક્ષક બોલીને સમજાવે હોણા કરતાં વિદ્યાર્થીઓ વાંચીને સમજે એવું કરીએ. દા.ત. 'જોકી/જૂઝમાં હોસો. આ પેજ પર આવતા સંજીવોનાં નામ લખો. તમારા વિસ્તારમાં જોવા સંજીવો કઈ કઈ કટું જોવા મળે છે તેની ચર્ચા કરો' આવી સૂચના હોય તો શિક્ષક સીધેરીંદ્રી હો સૂચનાને મૌનિક રીતે ન સમજાવવી. આમ કરવાને બદલે વિદ્યાર્થીઓને પૂછતું કે, 'આ સૂચનામાં આપણને શું કરવાનું કર્યું છે?' આમ કરવાથી વિદ્યાર્થીઓ સૂચના જાતે વાંચશે અને સમજવાની કોશિશ કરશે. આ સમજવાની કોશિશ દરમિયાન થતી માનરિક પુરુષા નાનું અગત્યાની છે. જોકી/જૂઝમાં હોલા હો કે તેથી વધુ વિદ્યાર્થીઓ પોતે શું સમજવા હો જોકીદાર કે અન્ય સંદર્ભોને સમજવવાનો પુલણ કરશે. આવી પુરુષામાં શરૂઆતમાં થોડો સમાચાર જશે, પરંતુ વિદ્યાર્થીઓ હેવાતી જશે તેમ તેમ જાપ આવતી જશે. હોલ્યુ જ નાની, વિદ્યાર્થી 'જવાબદાર' વાચક બનશે. હોલી કે પોતે હો સમજી શશે કે જી તથા તે ત્યાંજવાનું હોય છે!

- કોઈપણ વિષયના પાઠ્યપુરતકમાં આપેલી રામગ્રી (વાક્યો-કક્ષા, આદૃતિ વગેરે) વિદ્યાર્થીએ વાંચીને સમજવાની છે. વિદ્યાર્થીઓને એ તક આપીએ. અલગતા, ક્યાંક જે તે વિષયના પારિશાસિક શબ્દો આવે તો શિક્ષકે સમજાવવા જોઈએ. જો કે જ્યારે જવાબદાર વાચક તરીકે સમજવા માટે વાંચતા હોઈએ ત્યારે આપણે પણ કેટલાક શબ્દોના અર્થ ધારીએ છીએ-અંદાજ લગાવીએ છીએ અને આપણો ધારેલો અર્થ મોટેભાગે સાચો હોય છે. દા.ત. વિશાળની પાઠ્યરામગ્રીમાં એવું આવતું હોય કે 'પાણીને ગરમ કરવાથી તેનું ઉષ્ણતામાન વધે છે. 100 ડિગ્રી તાપમાન થાય ત્યારે પાણી ઉક્ખે છે. પાણીનું તાપમાન 100 ડિગ્રી પછી વધતું નથી. આમ, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે.' આ વાક્યોમાં ઉષ્ણતામાન કે ઉત્કલન બિંદુ શબ્દો વિદ્યાર્થી માટે નવા હોય તો પણ વાક્યના બાકીના પરિચિત શબ્દો અને સંદર્ભ પરથી એ એવું સમજશે કે અહીં તાપમાનને લગતી વાત છે.
- આપણા વિષયશિક્ષણ અંતર્ગત નિયમિત રીતે એકાદ બે વિદ્યાર્થીઓ વર્ગમાં મુખ્ય વાચન દ્વારા વિષયવસ્તુ વાંચે અને પોતે આમાં શું સમજ્યા છે એવું કહે તેવી પરંપરા વિકસાવીએ.
- એવું સુનિશ્ચિત કરીએ કે દરેક વિષયના દરેક તાસમાં ઓછામાં ઓછા બે ત્રણ વિદ્યાર્થીઓ પાસે બે ત્રણ સંંગ વાક્યોનું મુખ્ય વાચન કરાવીએ. વિદ્યાર્થીઓ વાંચી લે પછી તરત જ એ અંગે પ્રશ્નો પૂછીએ કે એ બે-ત્રણ વાક્યોમાં કયા મુદ્દા અંગે શું વાત કરવામાં આવી છે? આમ કરવાથી વિદ્યાર્થીઓનું વાચન તો સુધરશે જ સાથે સાથે આપણો અભ્યાસકર્મનો મુદ્દો પણ આગળ વધશે.
- વાચન અર્થગ્રહણ માટે યોગ્ય વાચન ઝડપ ખૂબ જ અગાત્ય ધરાવે છે. વિદ્યાર્થી મુખ્ય વાચન કરે તો જ શિક્ષકને ખબર પડે કે વિદ્યાર્થી યોગ્ય ઝડપથી અને યોગ્ય આરોહ-અવરોહ સાથે વાચન કરે છે કે કેમ. વર્ગ દરમિયાન થતા મુખ્ય વાચનની એ પણ ખ્યાલ આવે છે કે કયા વિદ્યાર્થીઓને ડિકોડિંગ સ્તરની (એટલે કે અક્ષરો કે શબ્દો ઓળખવાની) પણ તકલીફ છે. આવા વિદ્યાર્થીઓને વર્ગમાં વારંવાર તક આપવાથી, મહાવરાને લીધે એમનું મુખ્ય વાચન કૌશલ સુધરશે.
- લેખન અતર્ગત, અગાઉ જણાવ્યા મુજબ 'લેખન એટલે લખીને સમજાવવું', આનો અર્થ એ થાય કે વિદ્યાર્થી જે જાણે છે તે જેમ બોલીને સમજાવી શકે છે તે જ રીતે લખીને પણ

• સમજાતી શકવા જોઈએ. આને આપણે સ્વતંત્ર લેખન કરી શકીએ. અલગતા, વિદ્યાર્થીઓ સ્વતંત્ર લેખન કરતાં થાય એ પહેલાંનું પગશિયું શુંતલેખનનું છે.

૦ શુંતલેખન: વર્ગમંડળમાં લાયાવતી લખતે આપણે અગત્યાના મુદ્રા કે લાક્ષ્ય બોર્ડ પર લખતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે બોર્ડ પર લખીએ એ વિગતો વિદ્યાર્થીઓ પોતાની નોટમાં લખે છે. શિક્ષક તરીકે આપણે દરરોજ આપણા વિષયની અગત્યાની વિગતોનું શુંતલેખન કરાવીએ. એકાદ એ લાક્ષ્ય જોઈએ શુંતલેખન કરાવીએ જેથી બધા વિદ્યાર્થીઓનું લખાણ ચકારી-સુધારી શકાય. આ પ્રવૃત્તિથી આપણાને ખ્યાલ આવશે કે કયા વિદ્યાર્થીઓ કેવા અક્ષરો-માત્રાઓ લખવામાં મુશ્કેલી અનુભવે છે. આના આધારે એ વિદ્યાર્થીઓ માટે આપણે સ્પેસિફિક ઉપચારાત્મક કાર્ય કરીએ.

૦ સ્વતંત્ર લેખન: વર્ગકાર્ય દરમિયાન જે તે વિષયવસ્તુ અંતર્ગત ઓછામાં ઓછાં બે ત્રણ લાક્ષ્ય વિદ્યાર્થીઓએ જાતે લખવાં પડે. તેવી તક આપીએ. વર્ગમંડળમાં સામાન્ય રીતે પૂછીતા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ ગૌણિક રીતે આપતા હોય છે. આપણે એકાદ પ્રશ્ન પૂછીને કરી શકીએ કે આ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થીએ જાતે પોતાની રીતે લખવાનો છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓને આ રીતે લખવામાં તકલીફ પડે તો એમને જુથ અથવા જોડીમાં એ પ્રશ્નનો જવાબ વિચારવા કહેલું. ત્યારબાદ તે વિદ્યાર્થીઓ પોતાના જૂથમાં એક સર્વેરંગત જવાબ લખે અને વર્ગ સમક્ષા રજુ કરે. ધીમે ધીમે આ પ્રવૃત્તિ વ્યક્તિગત કરાવવી.

આમ દરેક ઘોરણના તમામ શિક્ષકો લાખાના એટલે કે વાચન-લેખનના શિક્ષકો છે. વિદ્યાર્થીઓને વાચન-લેખનની 'ગોટ વે સ્કીલ' શીખવી દીધા પછી એટલે કે 'વાંચીને સમજતાં અને લખીને સમજાવતાં' શીખવી દીધા પછી શિક્ષકનું આગળનું કામ ધણું સરળ બની જાય છે. આનાથી આપણા વિષયનું ધણું બધું વિષયવસ્તુ વિદ્યાર્થીઓને સ્વ-અધ્યાયન માટે આપી શકાય છે.

~~૦૧૬૭~~ ગણન અંતર્ગત પણ ઘોરણ ૨ અને ૩ માં આવેલા વિદ્યાર્થીઓનાં રિપોર્ટ કાર્ડ છે, જેના આધારે જત વધે ઘોરણ ૧-૨ ના શિક્ષકોએ ઉપચારાત્મક કાર્ય કર્યું હશે, નવા સત્રમાં આ બાળકો માટે ઘોરણ ૨-૩ માં ઉપચારાત્મક ચાલુ રાખીએ.

ગણનમાં મુખ્યત્વે રંધ્યા ઓળખ અને ગાણિતિક કિયાઓ એ ગુજરાત ગાયન કોથાલ્ય છે. દરેક બાળક પોતાના ધોરણ અનુસાર સંખ્યા ઓળખ અને ચાર ગુજરાત કિયાઓ કરી શકવું જોઈએ, આ લઘુતમ અપેક્ષા છે.

કેટલાંક બાળકોને ધોરણ 1 દરમિયાન બે અંકની સંખ્યાઓ શીખવામાં કેટલીક મુશ્કેલી રહી ગઈ હોય તો તેમને સૌ પહેલાં એ ઓળખ શીખવવી જરૂરો છે. બે અંકની સંખ્યાઓ ન ઓળખનાર બાળક પછીથી ત્રણ, ચાર કે વધુ અંકની સંખ્યાઓ ઓળખી નહીં શકે, પરિણામે ગાણિત વિષયના મોટાભાગના મુદ્દાઓના શિક્ષણ કાર્ય દરમિયાન એ નિષ્ઠિ રહેશે. ગાણિત જેવું સહજ અને સ્પષ્ટ 'વિકાસાત્મક આવર્તન' ધરાવતી અધ્યયન નિષ્પત્તિઓ માટે ઉપયારાત્મક કાર્ય કરવું સરળ છે.

આ ઉપરાંત, ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ગાણિતના જે તે ધોરણના પાઠ્યપુસ્તકના પહેલા એકમમાં અગાઉના ધોરણમાં શીખી ગયેલા મોટાભાગના મુદ્દા સામેલ થઈ જતા હોય છે. તેથી પહેલા એકમના શિક્ષણકાર્ય દરમિયાન આપણી શીખવવાની ગતિ ધીમી કરીને પણ, બધાં બાળકો પહેલો એકમ બરાબર સમજે એ સુનિશ્ચિત કરીએ.

પહેલા એકમ બાદ પણ અમુક બાળકોને સંખ્યાઓ કે સાદી કિયાઓમાં તકલીફ પડે એ શક્ય છે. આ સંજોગોમાં એ બાળકો માટે આખા વર્ગના શિક્ષણ કાર્યને રોકવાની જરૂર નથી. આખા વર્ગનાં મોટાભાગનાં બાળકો જે તે એકમ શીખતાં હોય ત્યારે - એ જ સમય દરમિયાન પાછળ રહી ગયેલાં બાળકોને એમની કચાશ દૂર કરવામાં મદદ કરી શકાય છે. દા.ત. કોઈ એક ધોરણમાં શિક્ષક ગુણાકારની રકમ બોડ્ડમાં લખીને બાળકોને ગુણાકાર શીખવે છે. વર્ગમાં ગુણાકાર શીખવતી વખતે, જે બાળકોને સંખ્યા ઓળખમાં મુશ્કેલી હોય તેમની પાસે બોડ્ડમાં લખેલી સંખ્યાઓ વંચાવવી, લખાવવી. એ જ રીતે જે બાળકોને સરવાળા કરવામાં મુશ્કેલી હોય તેમને, ગુણાકાર અંતર્ગત આવતા સરવાળા દરમિયાન સક્રિય ભાગીદાર બનાવવા. આમ કરવાથી, નિયત સમયમાં અધ્યાસકમ પૂર્ણ કરવાનું કાર્ય પણ થશે અને સાથે સાથે પાછળ રહી જતાં બાળકોને સંખ્યાજ્ઞાન અને સરવાળા પણ શીખવી શકાશે. આ જ રીતે સરવાળા-બાદબાકી શીખવતી વખતે સંખ્યાજ્ઞાનનું ઉપયરાત્મક કાર્ય, ગુણાકાર-ભાગાકાર શીખવતી વખતે સંખ્યાજ્ઞાન ઉપરાંત સરવાળા-બાદબાકીનું ઉપયરાત્મક કાર્ય કરીએ.

સંખ્યાજ્ઞાન શીખવતી વખતે હુંમેશાં સ્થાનકિંમતની ચર્ચા કરીએ જ. સંખ્યા બોલવામાં પણ ધ્યાન રાખીએ. દા.ત. સંખ્યા 56 બોડ્ડમાં લખી છે, તો એને પાંચડ છગડ છપ્પન ને બદલે

પચાસ ને છ છઘના એમ બોટીએ. વિદ્યાર્થીઓ પણ એ જ રીતે સંખ્યા બોલે એવો આગ્રહ રાખીએ. બાળાદી વિદ્યાર્થીઓની સંખ્યા અંગેની સમજ વાધુ ફક્ત બને છે. સ્થાનકિર્માની સમજવામાં પણ સરળતા રહે છે. સ્થાનકિર્માની સમજ સાથે હજાર સુધીનું સંખ્યાશાન શીખેલું બાળક, ભવિષ્યમાં ખૂબ મોટી સંખ્યાઓ સરળતાદી સમજુ શકશે.

૭,૮,૯

ગણન અંતર્ગત એક બીજુ પણ સામસ્ય થાય છે. પણીવાર વિદ્યાર્થીઓને (સંખ્યા ઓળખ અને સરવાળા, બાદબાકી, ગુણકાર, ભાગકાર જેવી) ગાણિતિક પ્રક્રિયાઓ આવકે છે. પરંતુ એના ઉપયોગના કોયડા નથી આવકતા, વર્ગમાં ભણાવીએ ત્યારે આવકે પણ કરોઈમાં ન આવકે! આવું કેમ થાય છે? જરા યાદ કરીએ. જ્યારે વર્ગમાં ભણાવીએ હીએ ત્યારે કોયડાની રકમ વિદ્યાર્થી જાતે સમજે છે કે રિક્ષક સમજાવે છે? જો કોયડાની રકમ હંગેશાં શિક્ષક જ સમજાવતા, હોય તો વિદ્યાર્થીને જાતે રકમ સમજતાં ન આવકે. હવે, કરોઈનાં પ્રશ્ન પૂછાય ત્યારે એ કોયડાની રકમ વિદ્યાર્થીએ જાતે સમજવી પડે, એટલે સરવાળો-બાદબાકી કે ગુણકાર-ભાગકાર આવકતા હોવા છતાં આ દાખલામાં આ ચાર કિયાઓ પૈકી શું કરવાનું છે અને કચા કમામાં કરવાનું છે એ વિદ્યાર્થીને સમજાતું નથી. હવે પછી જ્યારે કોયડો શીખવાલાનો થાય ત્યારે એ કોયડાનું ચોકએક વાક્ય છૂટું પાડીને/ખોલીને વિદ્યાર્થી જાતે જ સમજે એવો આગ્રહ રાખીએ. આના લીધે ધીરે ધીરે વિદ્યાર્થીને એ કોયડા સમજાવા માંડશે. પ્રક્રિયાઓ આવકે છે એટલે કોયડો ઉકેલતાં પણ આવકરે.

આમ, ગત વર્ષે યોજાએલ કસોટીના પરિણામ આધારિત ધોરણ ૨ થી ૪ ના દરેક વિદ્યાર્થીને લાયન, લેખન અને ગણનમાં પોતાના ધોરણ મુજબની પારંગતતા સુધી પહોંચવામાં મદદ કરીએ.



પાયાની સાક્ષરતા અને ખોટ શાન

| 3289 - 321  
ક્રમાંક : ગુજરાત રોકાનીએન્ડિ/2024  
ગુજરાત રોકાની સંશોધન અને તાલીમ પરિષદ,  
'વિદ્યાભવન', સેક્ટર-12, ગાંધીનગર  
ફોન : (079) 23256813-39  
નિયામક : (079) 23256808  
સચિવ : (079) 23256813  
e-mail : director-gcerl@gujarat.gov.in  
Web : www.gcerl.gujarat.gov.in  
તારીખ : / 06 / 2024

પ્રતિ,

પ્રાચાર્યશ્રી,

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,

તમામ

27 JUN 2024

વિષય: ધોરણ 2 થી 8માં વિદ્યાર્થીઓના વાચન લેખન, ગણન વિકાસ માટે આયોજન કરવા અંગે  
સંદર્ભ : અત્રેન્ડિજચેરીનો પત્ર No. GCERT/ C&E/ નિપુણ/12401-12513 તા : 15.06.2024

શ્રીમાન,


ઉપરોક્ત વિષય અને સંદર્ભ અનુબદ્ધ જણાવવાનું કે NEP-2020માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાના ગણનનાં કૌશલ્યો એટલે કે FLN કૌશલ્યોમાં પારંગત બનાવવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવેલ છે.

જે સારુ આપના જિલ્લા માટે ધોરણ 2 થી 8ના બાળકોના વાચન-લેખન-ગણનને વિકસાવવા નીચે મુજબની બાબતોને ધ્યાને લઇને સ્થાનિક જરૂરિયાત મુજબનું વાચન-લેખન-ગણનનાં શિક્ષણકાર્ય, મૂલ્યાંકન અને મોનિટરિંગ માટેનું યોગ્ય આયોજન તેમજ ફોલોઅપ કાર્ય આપની કક્ષાએથી કરી અત્રેની કચેરીને તા. 01 જુલાઈ, 2024 સુધીમાં જાણ કરવાની રહેશે.

1. વર્ગના બાળકો વાચન-લેખન-ગણનમાં કચાશ ધરાવે છે તે શાળાના શિક્ષકો જ સૌથી સારી રીતે સમજું શકે છે. આથી તમામ શિક્ષકોએ બાળકોની જરૂરિયાત મુજબ વાચન-લેખન-ગણન માટે શિક્ષણકાર્ય કરાવવાનું રહેશે. આ માટે ડાયેટ ફેફલ્ટી, બીઆરસી, સીઆરસી તેમજ બીઆરપી -નિપુણ દ્વારા શિક્ષકોનું હેન્ક હોલ્ડિંગ કરીને બાળકોના પાયાના વાચન-લેખન-ગણનના કૌશલ્યો વિકસાવવામાં સહાયરૂપ બનવાનું રહેશે.
2. ધોરણ 2 થી 8 ના તમામ શિક્ષકોએ પોતાની શાળાનું પ્રત્યેક વર્ગના બાળક જે તે ધોરણ પૈકીની વાચન-લેખન-ગણનમાં કચાશ ધરાવે છે, તેની નોંધ રાખવાની રહેશે.
3. ધોરણ 2 થી 8 ના તમામ શિક્ષકોએ પોતાના વર્ગના પ્રત્યેક બાળકની વાચન-લેખન-ગણનમાં રહેલી કચાશ દૂર કરવા માટે વ્યક્તિગત ઉપયોગિતા કાર્ય કરાવવાનું રહેશે. આ સારુ સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ યોગ્ય આયોજન કરવાનું રહેશે.
4. વર્ગના મોટાભાગનાં બાળકો વાચન-લેખન-ગણનમાં કચાશ ધરાવતા હોય તેમના માટે સામૃદ્ધિક ઉપયોગિતા કાર્ય કરાવવાનું રહેશે. આ સારુ સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ યોગ્ય આયોજન કરવાનું રહેશે.

5. આ પ્રાચીન ઉપયોગાત્મક કાર્ય માટે ખોરણ રૂ ધી રૂ લા તમામ વિશેષે સમયનું દોડું અધ્યોજન કરી વિદ્યાર્થીઓના વાયન-લોભન-ગણનના ડોશાલોંમાં રહેતી કાયા દર કરવા પણની કરવાના રહેશે.
6. આરોગ્ય પાયારીની, આરોગ્ય વ્યાખ્યાતા, BRCC, CACI તેમજ BPP NIPUN દ્વારા આ વાયન-લોભન-ગણન વિકાસ માટેના ઉપયોગાત્મક વિશેષજ્ઞાનનું સમયાતરે મોનિટરિંગ કરી જાયેદ બાને શિપોટીંગ કરવાનું રહેશે.
7. રાજ્ય દ્વારા સમયાતરે કલાર મૂલ્યાંકન પઠેલાં પોતાના વર્તના વિદ્યાર્થીઓને વાયન-લોભન-ગણન ડોશાલોંમાં પારંગત કરવાના રહેશે.

સદર કાયની ગંભીરતાને પછાને લઈને આધ્યોજન બાને અમલીકરણની અમગીરી માટે આગળની કાયવાહી કરવા આદી આપને જણાવવામાં આવે છે.



(દ્વારા વિદેશી )

નિયમક,

જીસીઓફાર્ટી,

ગાંધીનગર

#### લાંબા સંવિનિથ રવાણી:

- માન. શિક્ષણ સચિવદ્વારી (પ્રા. અને મા. શિક્ષણ), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
- માન. સ્ટેટ પ્રોફેસ્ટ ડાયરેક્ટરની, સમગ્ર શિક્ષણ, ગાંધીનગર
- માન. નિયમકની, પ્રાથમિક શિક્ષણ કાર્યેરી, ગાંધીનગર